

Date: 12-02-2022

To,
Gen. Manager (DCS)
BSE Limited.
P J Towers, Dalal Street,
Fort, Mumbai-400001

SUB: INTIMATION OF ADVERTISEMENT IN NEWSPAPER UNDER REGULATION 47 OF SEBI (LISTING OBLIGATIONS AND DISCLOSURE REQUIREMENTS) REGULATIONS 2015.

REF: COMPANY CODE BSE: 531257 (PRATIKSHA CHEMICALS LIMITED)

Dear Sir,

Please find enclosed herewith copy of Advertisement given in newspaper of unauditedfinancial results for the quarterended on 31st December, 2021in compliance of Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The said financial results were reviewed by Audit committee and approved by the Board of Directors at its meeting held on 11th February, 2022.

You are requested to take the same on your record.

Thanking You.


Yours Sincerely,

FOR, PRATIKSHA CHEMICALS LIMITED

MR. JAYESH PATEL

DIRECTOR

(DIN: 00401109)



# PRATIKSHA CHEMICALS LIMITED

Regd. Off: 3rd Floor, H. K. Complex, Nr. Dharnidhar Derasar, Paldi, Ahmedabad-380 007 India

Ph. 26632390, 26609530 Fax No: +917926612843.

Website: http://www.dharapratiksha.com E-mail: exports@dharapratiksha.com

CIN: L24110GJ1991PLC015507

Factory: 195/2, Near Natraj Industrial Estate, Village Iyawa Vasna, Sanand.

(Dist: Ahmedabad) India. Phone 02717-284350

Zomato net loss narrows 81% to Rs 66 cr

# CHANAKYA

**NI POTHI** 

#### Centre's GDP deflator forecast for FY23 is 3-3.5%: FM Nirmala Sitharaman

Finance Minister Nirmala Sitharaman said on Thursday that the Centre's gross domestic product (GDP) deflator projection for 2022-23 is 3 to 3.5 per cent.

This means that the government's own real GDP growth projection for the coming fiscal year is in the range of 7.6-8.1 per cent, given that the Union Budget assumes a nominal GDP growth rate of 11.1 per cent for FY23.

GDP deflator, or implicit price deflator, is a measure of inflation and is the difference between nominal GDP and real GDP.

"Our GDP projection in the Budget is based on the advance estimates of the National Statistical Office. One should recall that the advance estimates were prior to the Omicron wave. In our assumptions, we have also taken the third wave into consideration. Therefore, our nominal GDP estimate is 11.1 per cent. We expect a deflator of 3 to 3.5 percent in FY23," Sitharaman said in the Lok Sabha while replying to the debate on the Union Budget.

The Budget does not give

real GDP estimates. The Economic Survey 2021-22, drafted by Principal Economic Advisor Sanjeev Sanyal, projected a real GDP growth rate of 8-8.5 per cent for FY23. The Centre considers the Survey's estimates a tad too optimistic.



Based on Sitharaman's statement, the finance ministry's own real GDP projection is closer to that of the Reserve Bank of India. The central bank on Thursday projected real GDP growth of 7.8 per cent in FY23. Interestingly, it projected retail inflation of 4.5 per cent for next

A deflator takes from both wholesale and retail inflation. WPI inflation has been in double digits this year. "Typically there is what is called reversion to the mean. That is, if WPI is very high this year,

RIL sets its drone biz plan in motion,

and higher than CPI, then it usually tends to be lower than CPI next year. It doesn't always happen. But it's a reasonable assumption. So if we have a reversion of the GDP deflator, next year it could be lower than CPI," Finance Secretary TV Somanathan had told.

> Speaking on other Budget-related issues in the Lok Sabha, Sitharaman said the Modi government had controlled revenue expenditure and expanded capital expenditure as the latter had a greater multiplier effect.

"For every rupee you spend in revenue expenditure, the multiplier is 45 paise. For every rupee you spend in capital expenditure, the multiplier is Rs 2.45. Revenue deficit has shown a visible decline because it does not give us the multiplier that we want. It is difficult to reduce revenue expenditure, but we have shown it can be done without causing much upheaval," she said.

Sitharaman also assured that if there is demand, the Centre will provide more funds for the flagship National Rural **Employment Guarantee Scheme** through supplementary demand

#### Whirlpool of India Q3 consolidated net profit down 38% to Rs 44 crore

Consumer durables maker Whirlpool of India Ltd on Thursday reported 38.1 per cent decline in consolidated net profit at Rs 44.19 crore for December quarter 2021-22 on account of lower demand and input cost inflation.

inventory step up gain on acquisition, the impact of which was substantially mitigated by price increase and cost productivity actions, said Whirlpool of India in a post earning statement.

> Total expenses were at Rs 1,498.60

> > Our



of India, a subsidiary of Whirlpool Corporation, said in a regulatory filing.

However, revenue from operations was up at Rs 1,541.95 crore during the quarter under review as against Rs 1,493.98 crore in the same period a year ago.

The profit was down "due to lower industry demand, unprecedented cost inflation and one-time amortisation of

showed a topline growth of 3.2 per cent with volumes getting impacted by a muted industry demand against a high comparator the previous year. We faced unprecedented cost inflation, the impact of which was substantially mitigated by calibrated price increases and cost productivity actions. Topline growth should recover through the year as the economy opens up, Managing Director Vishal Bhola said.

On the outlook, he said,

"Looking ahead into Q4 FY22

for the standalone operations,

while demand continues to

remain robust, supply chain

issues persist and are creating

a big hangover especially in the

Kalyani further said, "We

expect both the domestic and

export markets to witness

positive sales development

across all major sectors barring

the Agri equipment sector in

For the international

operations, he said, "While the

demand is robust, severe and

unprecedented inflationary

export markets."

India."

#### **Bharat Forge reports** consolidated net profit of Rs 422 cr in Dec quarter

Auto components major Bharat Forge Ltd on Thursday reported a consolidated net profit of Rs 422 crore in the third quarter ended December

The company had posted a consolidated net loss of Rs 210.45 crore in the same quarter last fiscal, Bharat Forge Ltd said in a regulatory filing.

Consolidated revenue from operations for the period under review stood at Rs 2,394.69 crore as compared to Rs 1,723.11 crore in the year-ago quarter, it added.

Total expenses were higher at Rs 2,093.39 crore as against Rs 1,633.88 crore, it added.

Bharat Forge Chairman & Managing Director BN Kalyani said the Q3 FY22 performance was on expected lines.

"Total sales were flat as compared to the previous quarter with exports revenues declining by around 10 per cent while the domestic revenues grew by 16.5 per cent," he said.

The drop in exports revenues were primarily on account of curtailment of production of Class 8 (heavy duty) trucks due to semiconductor chip shortage, Kalyani said.

cost pressures across all variable cost elements are expected to take a toll on the profitability of our companies in Europe in the initial quarters of CY22 and we are actively engaged with customers in recovery of these cost increases.

In a separate filing, Bharat Forge said it has entered into a power purchase agreement and share subscription and shareholders' agreement with Avaada MHVidarbha Pvt Ltd (AMHVPL) to purchase solar power on a single captive user

As part of the agreement, it will acquire 26 per cent equity stake in AMHVPL for Rs 11.37 crore, the company added.

#### **IPO-bound Ola eyes NBFC** acquisition to expand fin services business

IPO-bound Ola is looking to expand its financial services business and also obtain an NBFC licence through the acquisition route, sources

Ola is said to be in talks to acquire at least 3 companies to augment its engineering, product as well as loan management capabilities to

support the rapid growth in the financial services business, two sources with direct knowledge of the development

The companies being considered for acquisition are registered non-banking financial companies (NBFCs), which offer both secured and unsecured loans.

### in Q3, revenue grows 86% This was dr

Food delivery company Zomato saw its net loss narrow by 81 per cent year-on-year (YoY) to Rs 66 crore in the December quarter (Q3). Meanwhile, its revenue rose 86 per cent YoY to Rs 1,112 crore

On a sequential basis, the foodtech company saw its revenue rise 9 per cent from Rs 1,024 crore in Q2, whereas net loss slimmed by 85 per cent from Rs 430 crore in Q2.

Zomato said it will continue to invest both in its core food business and in quick commerce, and raised the upper bound of potential investments in this category to \$400 million cash over the next two years. It is also in the process of setting up a non-banking financial company (NBFC), which will help it provide credit to customers, restaurants and delivery partners. According to media reports, the foodtech major is planning to offer its own "buy now, pay later" service.

The company said it has around \$1.7 billion of cash on its balance sheet and has made investments worth around \$225 million in the past year across three companies — Blinkit (erstwhile Grofers), Shiprocket,

The gross order value (GOV) grew by 84.5 per cent YoY and 1.7 per cent QoQ to Rs 5,500 crore in Q3FY22. "We believe that the weak QoQ growth in GOV was primarily due to reduction in customer delivery charges, in addition to a soft impact of post-Covid reopening (including some shift from delivery to dining out)," said the company.

"Over the years, unit economics in our food delivery business have improved with scale. Contribution margin (as a percentage of GOV) has improved steadily from -15 per cent back in 2019 days to 1 per cent today. Around a 5 per cent contribution margin in our food delivery business (at the current scale) should get us to Ebitda breakeven as a company (covering all common corporate costs as well)," said Deepinder Goyal, chief executive officer and founder of Zomato, in a blog post.

The number of orders grew 93 per cent YoY and 5 per cent QoQ. Average order value shrank around 3 per cent QoQ, mostly on account of reduction in customer delivery charges. Meanwhile, customer delivery charges contracted 22 per cent.

This was driven by Rs 7.5 per order reduction in customer delivery charges in Q3.

According to the company, part of the reduction in customer delivery charges is also because it started operations in around 180 new cities (the company is now in a total of more than 700 cities), where it has introduced temporary free delivery to cultivate a culture of ordering food from restaurants.

"We re-distributed our growth investments more in favour of discounts on customer delivery charges visa-vis food coupons. We are seeing higher return on investment with discounted delivery charges as compared to coupons. As a result, discounts per order reduced by Rs 5 per order in the last quarter as compared to Q2 of FY22," said Goyal.

The company's B2B supplies business - called Hyperpure – saw a rise in revenue of 168 per cent YoY and 40 per cent QoQ to Rs 160 crore in the December quarter. The service is now present in nine cities and supplied to over 27,000 unique restaurants in the third quarter - up 50 per cent from the September quarter.

#### Hindalco PAT jumps 96% in December quarter, stands at Rs 3,675 crore

Hindalco Industries Ltd, FY21, a jump of 96 per cent y-Aditya Birla Group's metals flagship, on Thursday reported a 95.7 per cent jump in consolidated profit after tax (PAT) to Rs 3,675 crore for the quarter ended December 31, 2021.

The results were driven by positive macros and focus on downstream value-added products along with better operating efficiencies.

The company had posted a consolidated PAT of Rs 1,877 crore in the year-ago quarter, Hindalco Industries said in a filing to the BSE. Its consolidated revenue from operations during October-December 2021 increased to Rs 50,272 crore, compared with Rs 34,958 crore in the year-ago period, the filing said.

"Consolidated PAT in Q3 FY22 rose to a record Rs 3,675 crore from Rs 1,877 crore in Q3 o-y," the company said.

Its consolidated revenue for the third quarter stood at Rs 50,272 crore, a jump of 44 per cent as against Rs 34,958 crore, Hindalco added. The company said that it reported its highest net profit in Q3 FY22, surpassing all previous quarterly performances.

The results were driven by a consistent performance by Novelis and an exceptional performance by India business, supported by favourable and an improved performance by the downstream business.

"Novelis continued to report consistent quarterly Ebitda despite challenges in the automotive segment due to the global semiconductor chip unplanned shortage, production downtime in South America and supply chain bottlenecks in Asia," it said.

Ebitda stands for earnings before interest, depreciation and amortisation.

Industries Hindalco Managing Director Satish Pai "Our sustained said, performance and strong balance sheet are driving our plans for further organic capex (capital expenditure). We have already announced over Rs 3,000 crore investments in our downstream pipeline – Hirakud and Silvassa, and the acquisitions of Ryker and Hydro's Kuppam units." Novelis has also announced capital projects that align market growth with sustainability considerations, Pai said."An example is the USD 365 million closed-loop recycling and casting centre for the North American market. Budget 2022 made clear the Indian government's intent and impetus on infrastructure," he

#### PRATIKSHA CHEMICALS LIMITED DHARNIDHAR DERASAR, VASNA, AHMEDABAD - 380007

CIN: L24110GJ1991PLC015507 www.pratikshachemicals.in

PH: 079-26632390 E-MAIL: exports@dharapratiksha.com

EXTRACT FROM THE STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE

QUARTER AND NINE MONTH ENDED ON 31.12.2021 (Rs. In Lacs)				
Sr. No	PARTICULARS	Quarter ended on 31.12.2021	For the nine month ended on 31.12.2021	Corresponding 3 Months Ended on 31.12.2020
1	Total income from operations	407.71	1179.85	287.22
2	Net Profit / ( Loss ) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	12.29	49.48	14.35
3	Net Profit / ( Loss ) for the period before Tax (after Exceptional and/or Extraordinary items)	12.29	49.48	14.35
4	Net Profit / ( Loss ) for the period after Tax (after Exceptional and/or Extraordinary items)	9.94	42.43	14.25
5	Total Comprehensive Income for the period [ Comprising Profit/ (loss) for the period (after tax) and other			
1	Comprehensive Income (after tax)]	9.94	42.43	
6	Equity Share Capital	557.03	557.03	557.03
7	Reserves ( excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of Previous Year	-217.74	-217.74	-233.68
8	Earnings Per Share ( of Rs. 10 / - each ) (for continuing and discontinued operations)			
1	Basic:	0.18	0.76	0.26
	Diluted:	0.18	0.76	0.26

Place: Ahmedabad

Date: 11th February,2022

. The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchange under Regulation 33 of SEBI (Listing and Other Disclosure Requirements) Regulation, 2015 The full Format of the financial Results are available on the Stock Exchange website (www.bseindia.com) and on the Company website ( www.pratikshachemicals.in )

2. The result of the Quarter ended on 31st December, 2021 were reviewed by the Audit Committee and approved by the Board of Director at its meeting held on 11th February, 2022.

> BY ORDER OF THE BOARD OF DIRECTORS, FOR, PRATIKSHA CHEMICALS LIMITED SD/-

JAYESH PATEL DIRECTOR (DIN: 00401109)

#### looks to become a key player Reliance Industries has put However, he points out that, for Asteria, drone expanding hardware will account for only

together an aggressive plan to build its drone business which includes manufacturing capacity fivefold, participating in the new drone production linked incentive scheme, and experimenting with limited logistics payloads to deliver goods.

The target is to become a key player in the expected \$5 billion market in India by the end of the decade.

The drone business is being carried out through a Bangalore-based start up, Asteria Aerospace, in which Reliance has taken a majority stake. Asteria is a subsidiary of Jio Platforms Ltd.

Neel Mehta, co-founder of Asteria, has an upbeat assessment of the global and Indian drone market. "In the next two years, we expect the global drone market (excluding large military drones) will be \$20 billion and the Indian market will be around \$1 billion, up from the current \$200 million, which will be about 4-5 per cent of the global pie.

This will go up to \$5 billion by the end of the decade. We plan to get a significant share of this market," he said.

Mehta says that with the government opening up the commercial drone sector in 2018 by lifting the earlier ban, the ratio between military and commercial drones will flip from 70:30 to 30:70 within the next two years.

Asteria estimates that there will be over 50,000-60,000 commercial drones in the skies in two years in India and the company will invest to expand its capacity in the Bangalore plant from 2,000 per annum to 10,000 drones very soon.

30 per cent of its revenues. It is drone as a service business which will account for the rest. This includes providing end-toend solutions for companies that encompass managing and running the drone, collecting data and analysing it, and offering the service on a single platform to the client.

Mehta says Astoria will participate in the drone Production Linked Incentive (PLI) scheme which has been announced by the government with a corpus of Rs 120 crore to

incentivise the sector.

"We will surely take advantage of the PLI scheme and our assessment is that the Rs 120 crore will be used up in just two years," said Mehta.

In the commercial space, Asteria is operating in many areas where Reliance is a large player such as oil and gas pipelines where increasingly surveillance and maintenance are being undertaken by drones which are replacing helicopters and manned security.

In telecom, drones have helped Reliance Jio maintain telecom towers and survey potential new tower locations. However, when it comes to last mile delivery through drones, Mehta believes it will take another five to six years for this to become a commercial reality.

"We don't see regulation enabling it soon, as this means new ways of traffic management and resolving various safety concerns. And you cannot have so many drones in the sky," he said.

Nevertheless, there are opportunities in logistics which

are opening up, especially in healthcare drones with payloads of 5-10 kilos transporting critical medicines from one place to another, especially in mountainous terrains where moving goods by road is timeconsuming. Mehta says Asteria is open to this opportunity and to building such drones.

He also says there is scope to use drones in middle mile logistics transportation from one hub to another. For this to work, though, it will require drones with flight paths of 200 kilometres and the ability to

"Currently, what you have are military drones which cost \$100 million for transportation logistics. Companies abroad are working to reduce costs and disrupt the market," said Mehta.

carry heavier payloads.

Asteria's drones have localisation levels for manufacturing of 60-65 per cent. They share the supply chain with electric vehicle and mobile device component makers as there is a lot of synergy among them in the areas of batteries, electric motors, and camera modules.

#### Sundram Fasteners posts 24% dip in Q3 net profit, revenue up 9%

Sundram Fasteners Ltd, a TVS Group company, has posted 24 per cent dip in consolidated net profit for the third quarter of the current financial year to Rs 110 crore as against Rs 144 crore during October to December quarter of 2020-21.

The company's consolidated revenue from operations posted for the quarter ended December 31, 2021 was up by 9 per cent to Rs 1,208 crore.

## અંક : ૧૩૯ પાનાં ૪ માલિક : જયની પબ્લીશર્સ તંત્રી : રણછોડ એન. શાહ સહ તંત્રી : રાધિકા ગંજવાલા તા.૧૨-૦૨-૨૦૨૨

## સેન્ટીમેન્ટમાં જે સુધારો જોવાયો હતો તે ફરી એક વખત ભૂંસાઈ ગયો

બજેટની જોગવાઈઓને કારણે સેન્ટીમેન્ટમાં જે સુધારો જોવાયો હતો તે ફરી એક વખત ભૂંસાઈ ગયો છે અને હવે આંતરરાષ્ટ્રીય બજારોમાં અમેરિકામાં જે તોતીંગ ફ્રગાવાનો દર છે તેને કારણે ભારત સહિત વિશ્વભરના શેરબજારોમાં મોટા પાયે વેચવાલી શરૂ થઈ ગઈ છે અને શુક્રવારે પણ સેન્સેક્ષમાં ખુલતાની સાથે ૬૦૦ પોઈન્ટનું ગાબડું પડી ગયું હતું તે જ પ્રકારે અમેરિકામાં પણ ગુરુવાર અને શુક્રવારે મોટા પાયે વેચવાલી જોવાઈ છે.

અમેરિકાને ફુગાવાને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવે છે અને અત્યારે ફુગાવાનો દર ૭ ટકા કરતા પણ વધી ગયો છે અને તે રીતે ફેબ્રુઆરી, ૧૯૮૨માં જે ફુગાવાનો દર હતો તેની કરતા પણ અત્યારે વધારે ઊંચું લેવલ આવી ગયુંછે અને તેની સાથે સાથે અમેરિકામાં ૧૦ વર્ષની ટ્રેઝરી ઉપરનું યીલ્ડ પણ સને ૨૦૧૯ પછી પ્રથમ વખત બે ટકા ઉપર આવી ગયું છે અને એક જ વર્ષમાં બે વર્ષની ટ્રેઝરી ઉપરનું યીલ્ડ ૨૬ બેઝિક પોઇન્ટ વધ્યું છે અને એક જ દિવસમાં આ પ્રકારનો ઉછાળો વર્ષ ૨૦૦૯ પછી પ્રથમ વખત છે.

ગયા અઠવાડિયે મળેલી ફેડરલ રિઝર્વની મીટીંગમાં જે સંકેત આપવામાં આવ્યો તેને કારણે અમેરિકાના અર્થશાસ્ત્રીઓ અને ઈન્વેસ્ટમેન્ટ એનાલિસ્ટોનું મંતવ્ય છે કે હવે વર્ષ ૨૦૨૨ દરમ્યાન સાત અલગ અલગ તબક્કામાં વ્યાજદરમાં વધારો કરવામાં આવશે. અને હવે જે રીતે ફુગાવો તોતીંગ દરે વધ્યો છે તે સ્પષ્ટ સંકેત આપે છે કે માર્ચ મહિનામાં જે ફેડરલ રિઝર્વની મીટીંગ આવવાની છે તેમાં ૫૦ બેઝિક પોઈન્ટનો વધારો આવે તે લગભગ નક્કી છે અને આ રીતે જો સાત વખત વ્યાજદર વર્ધ તો કુલ ૩.૫૦ ટકાનો વ્યાજદર વધી શકે જે ખૂબ જ મોટું આકર્ષણ અમેરિકન ઇન્વેસ્ટરો માટે છે.

છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન અને મુખ્યત્વે કોરોના મહામારી દરમ્યાન અમેરિકામાં જે હળવી વ્યાજનીતિ ચાલી રહી છે તેને કારણે ટોચના ફંડ હાઉસ દ્વારા સોના, ચાંદી, કૂડ, કોપર તેમજ ભારત જેવા વિકાસશીલ દેશોમાં મોટા પાયે રોકાણ કર્યું હતું. કારણ કે વ્યાજદર અમેરિકામાં પણ ગુરુવાર અને શુક્રવારે મોટા પાયે વેચવાલી

વધારે મોટો નફાનો માર્જિન મળતો હતો, પરંતુ હવે જો ટ્રેઝરી ઉપરનું વ્યાજદર જ બે ટકાથી વધીને પથી ૫.૫૦ ટકા આસપાસ આવી જાય તો સ્વાભાવિક છે કે તેમને ભારત જેવા થોડા જોખમવાળા શેરબજારમાં રોકાશ કરવાને બદલે અમેરિકન સરકારની જામીનગીરીઓ કે જે વિશ્વમાં સૌથી સલામત રોકાણ મનાય છે તેમાં જ રહ્યા છે. રોકાણ કરવાનું પસંદ કરે. અત્યારે અમેરિકન અર્થતંત્ર અંગે ભલે કેટલાક એનાલિસ્ટો નકારાત્મક મંતવ્યો દર્શાવતા હોય કે અમેરિકા ગળાડૂબ દેવામાં ડૂબેલો દેશ છે પરંતુ વાસ્તવિકતા એ છે કે વિશ્વના મોટા ભાગના ઈન્વેસ્ટરો અને જેમાં ચીનનો પણ સમાવેશ થઈ જાય છે તે અત્યારે અમેરિકન ડોલર અને અમેરિકન સરકારની જામીનગીરીઓને સૌથી સલામત રોકાણ તરીકે માને છે. અને તેથી જો આવા સલામત રોકાણ ઉપર જ આવું સુંદર વ્યાજ છૂટતું હોય તો શા માટે તેઓ ભારત જેવા જોખમ ધરાવતા શેરબજારમાં રોકાણ કરે ? અને આગામી દિવસોમાં એફઆઈઆઈની મોટા પાયે વેચવાલી ભારતીય શેરબજારમાં જોવાય તે ભય

નહિવત જેટલો હતો અને તેની

સરખામણીમાં ઓછા નફાથી પણ તેમને

ખૂબ મોટો છે. સરકાર આપણી રિઝર્વ બેંક કે પછી આપણા એનાલિસ્ટો આપણા શેરબજાર અને આપણા અર્થતંત્ર અંગે ભરપૂર વખાણ કેમ ન કરતા હોય પરંતુ જ્યારે એફઆઈઆઈની આવી મોટી વેચવાલી અદશ્ય થઈ જાય છે અને આ જ પ્રકારનો ટ્રેન્ડ આગામી દિવસોમાં ભારતીય શેરબજારમાં જોવાય તે સંભાવના ખૂબ મજબૂત છે.

બેંકની મીટીંગ જે ગયા અઠવાડિયે મળી હતી તેમાં ફરી એક વખત વ્યાજદરમાં વધારો કરવાનું તેમણે ટાળી દીધું છે. અગાઉના રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના

હતા, જયારે રિઝર્વ બેંકના અત્યારના ગવર્નર આર્થિક બાબતો સિવાય અન્ય બાબતોમાં કાબેલિયત ધરાવે છે અને તેથી સ્વાભાવિક છે કે તેઓ સરકારના નાખશ કરીને અર્થતંત્ર અંગે હિંમતભર્યા પગલાં લેતા અચકાય અને એટલે જ તેમના કાર્યકાળ દરમ્યાન રિઝર્વ બેંકે ખૂબ જ મોટી રકમનું ડિવિડન્ડ સરકારને ચૂકવી દીધું અને તેવી જ રીતે અત્યારે પણ તેઓ વ્યાજદરને વધારવાનું ટાળી

અત્યારે કેવળ અમેરિકામાં જ નહિ પરંતુ વિશ્વના અન્ય દેશોમાં પણ વ્યાજદર વધારવાનું શરૂ થયું છે અને તેથી આ ટ્રેન્ડ કદાચ એક કે બે મહિના તેઓ ટાળી શકશે, પરંતુ તે પછીના સમયગાળામાં તેમણે રાજકીય નેતાગીરી નાખુશ થાય તો પણ વ્યાજદર વધારવા સિવાય કોઈ જ વિકલ્પ નથી રહેવાનો અને જયારે ભારતમાં પણ વ્યાજદર વધશે ત્યારે ટેમ્પરરી ધોરણે તો કંપનીની નફાશક્તિને અસર પડે તે સ્વાભાવિક છે. દરેક કંપની પોતાની પ્રોડક્ટની કિંમત તરત નથી વધારી શકતી અને તેથી વ્યાજદર વધે અથવા તો ક્રૂડને કારણે ક્રુગાવો વધે અને તેમની કાચામાલની અને અન્ય પડતરો ઊંચી જાય ત્યારે કંપનીઓના નફાને મોટો ફટકો પડે છે અને આ જ ટ્રેન્ડ આપણે આવા માહોલમાં ભલે આપણી ડિસેમ્બર ક્વાર્ટરના તમામ સિમેન્ટ કંપનીઓના પરિશામો જોયો. સિમેન્ટની માંગમાં સુંદર ઉછાળો હોવા છતાં આ કંપનીઓ કૂડતેલનો ભાવ વધારો અને ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધ્યો હોવા છતાં સિમેન્ટની કિંમતો નથી વધારી શકી અને આવી રહી હોય અથવા તો આવવાની તેથી મોટા ભાગની સિમેન્ટ કંપનીઓના હોય તો ભલભલા તેજીના કારણો આંકડા ખરાબ આવ્યા છે અને આ જ પ્રકારનો ટ્રેન્ડ આગામી સમયગાળામાં ફુગાવા અને વ્યાજદરને કારણે અન્ય સેક્ટરની કંપનીઓમાં પણ જોવાય તે ભય છે. આમ વિવિધ દલીલોનું તાત્પર્ય બીજી તરફ ભારતીય રિઝર્વ એક જ આગામી દિવસોમાં ભારતીય બજારમાં વધઘટનું પ્રમાણ તેમજ પ્રોફિટ બુકિંગ અને ઘટાડાનું પ્રમાણ વધારે હશે અને એકદમ સિલેક્ટીવ શેરોમાં જ તેજીમય માહોલ જોઈ શકાશે. અને તેથી ગવર્નરો આર્થિક બાબતોના નિષ્ણાત હવેના તબક્કે ખૂબ જ સંભાળીને કામ



ભારોભાર નબળો ટ્રેન્ડ છે. રૂા. ૮૮૦

્પર આવી ગયેલા આ શેરમાં આવતા

થોડા દિવસોમાં નવા તીવ્ર ઘટાડા સાથે

રૂા. ૮૬૭ અને તે પછી એક તબક્કે રૂા.

૮૪૨ સુધી ભાવ ઉતરી જાય તો પણ

દામાણીનું હોલ્ડિંગ ધરાવતી ઇન્ડિયા

સિમેન્ટમાં તો સિમેન્ટ ઉદ્યોગની તેજી

વખતે પણ ખાસ કોઈ કસ નહોતો. રૂા.

૨૬૦ ટચ કર્યા પછી આ શેર અત્યારે

રૂા. ૨૨૦ ઉપર આવી ગયો છે અને

આવતા થોડા દિવસોમાં વધારે તીવ્રતાથી

ઘટીને રૂા. ૨૦૮ સુધી ઉતરી જાય તે

ભારતમાં મજબૂત માર્કેટ ધરાવે છે તેના

શેરમાં પણ અત્યારે નબળાઈ શરૂ થઈ

ગઈ છે. રૂા. ૧૮૫ પહોંચ્યા પછી આ

શેર અત્યારે રૂા. ૧૭૦ ઉપર છે અને

આવતા થોડા દિવસોમાંતેમાં એકદમ

નાના ઘટાડા સાથે રૂા. ૧૬૪ સુધી ભાવ

ઉતરી જવાની ગણતરી છે.

નફાશક્તિની સરખામણીમાં ઓરીએન્ટ

સિમેન્ટ પહેલેથી જ નીચા વેલ્યૂએશન

ઉપર હોવાથી તેમાં મોટો ઘટાડો નથી

ડિસેમ્બર ક્વાર્ટરના આંકડા ગયા

અઠવાડિયે આવ્યા અને તે આંકડામાં

કોઈ લાંબો કસ નથી દેખાતો અને તેથી

આવતા થોડા દિવસોમાં આ શેરમાં મોટા

પાયે વેચવાલી ઊભી થાય તો નવાઈ

નહિ લાગે. સાંઘી અત્યારે રૂા. ૫૫ની

અંદર ઊતરી ગયો છે અને આવતા થોડા

દિવસોમાં વધુ ઘટીને રૂા. પર અને તે

પછી રૂા. ૫૦નો ભાવ બતાવી દે તે

સિમેન્ટમાં પણ શોર્ટટર્મ ઘટાડાનો ટ્રેન્ડ

શરૂ થઈ ગયો છે. અત્યારે રૂા. ૭૦ની

અંદર ઉતરી ગયેલા આ શેરમાં મોટા

ઘટાડા સાથે ર્રા. ૬૭ અને તે પછી ર્રા.

દયનો ભાવ જોવા મળી જવાની

સંભાવના મજબત છે અને તેથી એકદમ

શોર્ટટર્મ એન્ગલથી આ શેરથી દૂર જ

સ્થાન ધરાવતી **જે.કે. સિમેન્ટ** 

નફાશક્તિની સરખામણીમાં આકર્ષક

વેલ્યૂએશન ઉપર છે તેમ છતાં આ શેર

પણ અત્યારે સ્પષ્ટ મંદીના તબક્કામાં

આવી ગયો છે. અત્યારે રૂા. ૩૧૮૫

ઉપરના આ શેરમાં આવતા થોડા

દિવસોમાં રૂા. ૩૦૦૦ની અંદર ભાવ

ઊતરી જાય તે ભય છે. શુક્રવારની એક

જ સેશનમાં આ શેરમાં રૂા. ૧૧૦નું

ગાબડું પડ્યું હતું તે પાસું ધ્યાનમાં રાખવું

પડે અને તેથી આવતી થોડી સેશોનો

દરમ્યાન આ શેરમાં વધારે તીવ્રતાથી

ભાવ તૂટે અને રૂા. ૩૦૦૦ની નજીક

આવી જાય તેવી ગણતરી છે. જયારે

જે.કે. લક્ષ્મી સિમેન્ટ અત્યારે રૂા.

પર૦ ઉપર ચાલે છે અને આ શેરમાં

પણ આવતા થોડા દિવસોમાં વધારે

તીવ્રતાથી ભાવ તૂટે અને એક તબક્કે

રૂા. પર૩ અને તે પછી રૂા. પ૧૩ સુધી

ઉતરી જવાની સંભાવના મજબૂત છે.

અને તેથી આ શેરમાં અત્યારના રૂા.

૧૨૭ના લેવલથી વધારે ઘટાડા સાથે

રૂા.૧૨૨નો ભાવ આવવાની ગણતરી

**પ્રીઝમ સિમેન્ટ**માં તો ઘણા

મધ્યભારતના માર્કેટમાં મજબુત

તે જ પ્રકારે શ્રી દિગ્વિજય

સંભાવના પૂરેપૂરી છે.

રહેવું સલાહભરેલ.

સામે પક્ષે સાંઘી સિમેન્ટના

ઓરીએન્ટ સિમેન્ટ કે જે પૂર્વ

ભય ખૂબ મોટો છે.

દેખાતો

તે જ પ્રકારે રાધાકિશન

સહેજેય નવાઈ નહિ લાગે.

કરવું જરૂરી છે. એક દિવસ બજાર ઊંચકાય અને બીજે દિવસે બજાર એકદમ તૂટી જાય તે પ્રકારનો ઝીગઝેગવાળો ટેન્ડ પણ જોવા મળે તેની તૈયારી પણ રાખવી.

શેરબજારને અસર કરતું એક ત્રીજું મહત્ત્વનું પરિબળ વિવિધ રાજ્યોની ચૂંટણીઓ છે અને આ ચુંટણીઓના આંકડા પણ બજારને મોટો આંચકો આપી જાય તો નવાઈ નહિ લાગે અને ખાસ કરીને ઉત્તરપ્રદેશ વિધાનસભાના પરિશામોની ખૂબ જ બારિકાઈથી અભ્યાસ થઈ રહ્યો છે. ઉત્તર પ્રદેશ દેશનું સૌથી મોટું રાજ્ય છે અને તેમાં ચૂંટણીના પરિણામ શું આવે છે તે જોવું ખૂબ જ રસપ્રદ છે.

આ પરિશામમાં જો ભાજપ માટે જો કોઈપણ નકારાત્મક ડેવલપમેન્ટ થયું તો તેની અસર પણ શેરબજાર ઉપર ખૂબ જ ગંભીર પડી શકે.

ઉપર ચર્ચા કરી તે મુજબ િડસેમ્બર ક્વાર્ટરમાં સિમેન્ટ કંપનીઓન<u>ી</u> નફાશક્તિને ગંભીર અસર પડી છે અને ક્રુડમાં જે ઉછાળો છે તે અટકે તેવી કોઈ સંભાવના નથી લાગતી. આંતરરાષ્ટ્રીય સ્તરે રશિયા અને યુક્રેન વચ્ચે પણ તંગદીલી વધી રહી છે અને તેની અસર અખાતી દેશોમાં કડૂતેલના ઉત્પાદન અથવા તો રશિયાના ક્રૂડતેલના ઉત્પાદન ઉપર પડે તો પણ નવાઈ નહિ લાગે અને આ પાસું હોવાને કારણે ક્રૂડમાં વધુ ને વધ તેજીમય ટ્રેન્ડ સિમેન્ટ કંપનીઓની નફાશક્તિની પત્તર ફાડી નાખશે.

બીજી તરફ કેન્દ્ર સરકાર દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટો અને ખાસ કરીને ગતિશકિત પ્રોજેક્ટ અંગે મહત્ત્વની જાહેરાતો અને જોગવાઈ કરવામાં આવી છે પરંતુ આ જોગવાઈઓ ક્યારે વાસ્તવિક બને તે વાત અલગ છે અને ત્યાં સુધી સિમેન્ટની માંગમાં મોટા ઉછાળાની સંભાવના ઓછી છે. ત્રીજી તરફ આંતરરાષ્ટ્રીય અસર હેઠળ રિઝર્વ બેંક અને હાઉસીંગ ફિનાન્સ કંપનીઓ અને બેંકો પણ હાઉસીંગ સેક્ટરમાં વ્યાજદર વધારશે અને તેને કારણે પણ રિયલ એસ્ટેટની જે માંગ છે. તેને થોડીક અસર પડવાની અને આ પાસાઓને લીધે આગામી સમયગાળામાં સિમેન્ટ શેરોમાં એકંદરે નબળાઈ જોવા મળે તે સંભાવના મજબૂત છે.

સેશનમાં શુક્રવારની અલ્ટ્રાટેકનો શેર રૂા. ૯૪ના ગાબડા સાથે રૂા. ૭૩૮૦ સુધી ઊતરી ગયો હતો અને અત્યારે આ શેર સ્પષ્ટ રીતે ઘટાડાના તબક્કામાં છે. ક્રૂડ વધુ ને વધુ મોંઘું થશે તે નક્કી છે અને તે અસર નીચે એકદમ શોર્ટટર્મમાં અલ્ટ્રાટેક સિમેન્ટના શેરમાં ઘટાડો અને નબળાઈ જોવા મળે તે સંભાવના મજબૂત છે. નીચામાં એક તબક્કે રૂા. ૭૨૨૨ સુધી ભાવ ઉતરી જાય તો પણ નવાઈ નહિ લાગે.

સામે પક્ષે પૂર્વ ભારતની બિરલા કોર્પ અત્યારે રૂા. ૧૨૫૭ ઉપર છે અને આ શેરમાં પણ હવે સ્પષ્ટ રીતે નબળાઈનો તબક્કો દેખાય છે. તાજેતરમાં આ શેરે રૂા. ૧૬૫૦નું ટોપ બતાવ્યા પછી તેમાં છેલ્લા ૨૦ દિવસો દરમ્યાન સતત ઘટાડાનો ટ્રેન્ડ જોવાયો છે. અત્યારના રૂા. ૧૨૫૭વાળા આ શેરમાં આવતા થોડા દિવસોમાં રૂા. ૧૨૨૭ અને તે લેવલ તૂટે તો રૂા. ૧૧૭૧ સુધી ભાવ ઉતરી જાય તેવી ગણતરી છે.

દક્ષિણ ભારતની ટોચની કંપની

ડ્રાઇવર ?

ડ્રાઈવર, રસોયા, नोड्२ शोधवा हवे ખૂબ જ સરળ staffavailable.com

ના એક્દમ અલગ પ્રકારના અને દેશમાં એકમાત્ર આવી સવલત ઓફર કરતાં પ્લેટફોર્મ ઉપ૨ તમારી જરૂરિયાત મૂકી દો

तद्दन ङी

સ્ટાર સિમેન્ટના શેરમાં પણ કોઈ કસ નથી દેખાતો.

દેશની બે ટોચની સિમેન્ટ કંપનીઓ **એસીસી**માં ડિસેમ્બર ક્વાર્ટરમાં નબળા આંકડા આવ્યા છે. એસીસી અત્યારે રૂા. ૨૨૬૯ ઉપર છે અને આવતા થોડા દિવસોમાં તેમાં રૂા. ૨૨૨૨ સુધી ભાવ ઉતરી જાય તો સહેજેય નવાઈ નહિ લાગે.

અંબુજા સિમેન્ટમાં વેલ્યૂએશન નફાશક્તિની સરખામણીમાં આકર્ષક છે પરંતુ આ શેર પણ સ્પષ્ટ રીતે મંદીના તબક્કામાં છે. અત્યારે રૂા. ૩૬૯ ઉપર છે અને આવતા થોડા દિવસોમાં રૂા. ૩૫૫ અને તે પછી રૂા. ૩૪૪ સુધી ભાવ ઉતરી જાય તે સંભાવના મજબૂત

દક્ષિણ ભારતની સિમેન્ટ કંપનીઓમાં પણ શોર્ટટર્મ ટ્રેન્ડ તદ્દન નબળો પડી ગયો છે અને તેમાં દાલમિયા ભારતના શેર અંગે ભલે ટોચના ફંડમેનેજરો બુલીશ હોય પરંતુ અત્યારના રૂા. ૧૯૨૨ વાળા આ શેરમાં આવતા થોડા દિવસોમાં રૂા. ૧૮૮૮ અને તે પછી રૂા. ૧૮૧૮નો ભાવ જોવા મળી જવાની ગણતરી છે. શોર્ટટર્મમાં આ શેરમાં ભારોભાર નબળાઈનો તબક્કો બેસે છે.

નિરમા ગ્રૂપની **નૂવોકા વિસ્ટા**માં પરિશામો બિનાકર્ષક આવ્યા છે. નૂવોકો વિસ્ટા અત્યારે રૂા. ૪૨૬ ઉપર છે અને આવતા થોડા દિવસોમાં તેમાં રૂા. ૪૨૦નો ભાવ જોવા મળી જાય તે સંભાવના ખૂબ મજબૂત છે. આ શેર અંગે કેટલાકે રૂા. ૭૦૦ અને કેટલાકે રૂા. ૮૦૦ના ભાવ જોવા મળશે તેવા રિસર્ચ રિપોર્ટ બહાર પાડ્યા છે પરંતુ અત્યારે તો આ શેરમાં સતત વેચવાલી ચાલુ રહે તે સંભાવના વધારે લાગે છે. અને તેથી તેનાથી દૂર જ રહેવું

જયારે મોટા ભાગના સિમેન્ટ શેરોમાં આવી હાલત હોય ત્યારે નાના અને પરચૂરણ સિમેન્ટ શેરો અંજિ પોર્ટલેન્ડ, બેરેક વેલી, સાગર સિમેન્ટ, શિવા સિમેન્ટ, કેસીપી લિમિટેડ, એમસીએલ ઇન્ડસ્ટ્રીઝ, **હિકલબર્ગ સિમેન્ટ** વગેરેથી દૂર જ રહેવામાં સલામતી છે અને નહિતર આ સિમેન્ટ જ તમારો પાળિયો બની જશે.

છેલ્લા ત્રણ ક્વાર્ટર દરમ્યાન માંગ સુંદર હોવાને કારણે સિમેન્ટ પ્રોડક્ટ કંપનીઓના વેચાણો અને નફાશક્તિમાં સુંદર ઉછાળો જોવાયો છે અને તેથી આ શેરોમાં રિરેટીંગ પણ ડ્યૂ છે. જેટલા પ્રમાણમાં સિમેન્ટ કંપનીઓની નફાશક્તિ દબાણ હેઠળ છે તેટલું દબાણ સિમેન્ટ શીટ અને સિમેન્ટ પાઈપ બનાવતી કંપનીઓ ઉપર નથી અને તેઓ હરિફાઈ ઓછી હોવાથી ભાવ વધારો કરી શકે છે અને આ પાસાને કારણે સિમેન્ટ પ્રોડક્ટ શેરોમાં મોટો ઘટાડો જોવા મળે તે ભય ઓછો

તેમ છતાં હૈદરાબાદ ઇન્ડસ્ટ્રીઝ કે જે હવે એચઆઈએલ નામ ધરાવે છે તેનો શેર અત્યારે ઘટાડાના તબક્કામાં છે. અત્યારે ઘટીને રૂા. ૪૦૮૦ સુધી આવી ગયેલા આ શેરમાં હજી થોડા દિવસો રૂા. ૪૦૩૬ અને તે તૂટે તો રૂા. ૩૯૮૯નો ભાવ બતાવી દે તે સંભાવના ખૂબ મજબૂત છે, પરંતુ મધ્યમગાળાના એન્ગલથી તે શેર ઉપર ફોકસ રાખી શકાય અને તેમાં રિટર્ન સારું છુટશે તેવી ગણતરી છે.

સિમેન્ટ પ્રોડક્ટ કંપનીઓમાં વિસાકા ઇન્ડસ્ટ્રીઝનો શેર પણ ખૂબ જ આકર્ષક છે. જે રીતે જીએચસીએલે ટેક્ષટાઈલમાં ખૂબ જ મોટું રોકાણ કરી નાખ્યું હતું અને તે આ વર્ષે ફળ્યું છે તે સમયથી આકર્ષણ અદશ્ય થઈ ગયું છે જ પ્રકારે વિસાકા ઇન્ડસ્ટ્રીઝ પણ ટેક્ષટાઈલમાંથી જંગી નફાશક્તિ ધરાવે છે. ૬૦૦ પોઈન્ટના ગાબડા છતાં પણ આ શેર ફક્ત રૂા. ૬ ઘટીને રૂા. ૬૦૦

ઉપર ચાલી રહ્યો છે અને તેમાં છેલ્લા ૧૨ મહિનાની નફાશક્તિ સામે કેવળ ૮.૭૧નો પીઈરેશિયો છે અને રૂા. ૩૭૧ની બુકવેલ્યૂ છે અને તે પાસાને કારણે આ શેરમાં જોખમ નહિવત છે અને થોડા થોડા શેરો આ તબક્કે ભેગા કરી શકાય.

રામકો ઇન્ડસ્ટ્રીઝ પણ ખૂબ જ સુંદર વેચાણો અને નફાશક્તિ ધરાવે છે. આ શેર અત્યારે રૂા. ૨૪૨ ઉપર ચાલી રહ્યો છે અને તેમાં પણ વેલ્યૂએશન ખૂબ જ આકર્ષક છે અને તેમાં જોખમ નહિવત.

એવરેસ્ટ ઇન્ડસ્ટ્રીઝ કે જે એસીસી હસ્તક છે તેના શેરમાં પણ અત્યારે રૂા. ૫૮૯ના ભાવે જોખમ મર્યાદિત છે. શેર ૧૮.૯૭ના પીઈરેશિયો ઉપર છે. બૂકવેલ્યૂ રૂા. ૩૨૫ છે અને તે રીતે અત્યારનો ભાવ ૧.૮૧નો બજારભાવ બુકવેલ્યૂ રેશિયો દર્શાવે છે અને તેથી તે શેર ઉપર ફ્રોકસ રાખી શકાય. આ તબક્કે જોખમ

બીજી તરફ સિરામિક ટાઈલ્સ અને ગ્રેનાઈટ બનાવતી કંપનીઓમાં આકર્ષણ નથી દેખાતું. **ઓરીએન્ટ** બેલ, નિર્ફો ટાઈલ્સ, એક્ઝારો પાઈપ, સોમાણી સિરામિક, સેરા સિરામિક, એશિયન એચએસઆઇએલ વગેરે શેરોમાં કોઈ કસ નથી દેખાતો અને તેમાં ભાવ નબળો ટ્રેન્ડ બતાવે તે ગણતરી છે.

પાઈપ અને ફિટીંગના ક્ષેત્રમાં થોડા સમય પહેલા આઈપીઓ લઈને આવેલી પ્રિન્સપાઇપ્સ અત્યારે રૂા. ૬૮૩ ઉપર ચાલે છે. આ શેરમાં ૨૯નો પીઈરેશિયો છે અને બુકવેલ્યૂની સરખામણીમાં પણ ભાવ થોડોક ઊંચો છે અને તેથી આ શેરમાં હજી કરેકશનનું દબાણ વધારે આવે તે ભય છે. અમદાવાદ ખાતે મુખ્ય મથક

ધરાવતી **એસ્ટ્રાલ** દ્વારા ડિસેમ્બર ક્વાર્ટર દરમ્યાન પણ ખૂબ જ સુંદર આંકડા રજ્ થયા છે. શેર અત્યારે રૂા. ૨૦૭૯ ઉપર ચાલે છે અને આ શેરમાં અત્યારે ૮૦.૬૯નો ગળે ન ઊતરે તેવો મોટો પીઈરેશિયો છે. બુકવેલ્યૂ ફક્ત રૂા. ૯૫ છે અને બજારભાવ / બુકવેલ્યુ રેશિયો ૨૧.૭૭ ઉપર ચાલી રહ્યો છે. આમ આવા ઊંચા પીઈરેશિયો ઉપર હવે આ શેરમાં વધવાની જગ્યા કેટલી તે તમારે સમજવું જોઈએ. વધારે ઊંચા ભાવની લાલચમાં તમે જૂના શેરો ભલે જાળવી રાખો પરંતુ આવા ઊંચા ભાવે નવું રોકાણ કરવાની અમારી સલાહ નથી. બીજાને ભલે રોકાશ કરવું હોય તો કરે, ગમે ત્યારે નેગેટીવ સમાચાર આવતા ભાવ રૂા. ૩૦૦-૪૦૦ કપાઈ જવાનો ભય ખૂબ મોટો છે. આવા ઊંચા ભાવનો એસ્ટ્રાલે લેવો તેને બદલે એશિયન પેઈન્ટ કે પછી પીડીલાઈટનો શેર લેવો વધારે ડહાપણનું કામ કહેવાય.

વિવિધ પ્રકારના કાચનું ઉત્પાદન કરતી **આસાહી ઇન્ડિચા**નો શેર ડિસેમ્બર અને જાન્યુઆરી મહિના દરમ્યાન ઓપરેટરોનો માનીતો શેર હતો અને તે પછી શેર અત્યારે રૂા. ૫૫૫ ઉપર સ્થિર થઈ ગયો છે. ૪૪.૭૦નું વેલ્યૂએશન છે અને તેથી આ શેરમાં બહુ મોટા ઉછાળાની જગ્યા હવે નથી દેખાતી. જૂનું રોકાશ હોય તો ભલે જાળવી રાખો.

**બિલ્ડપ્રો** રીયલ સંકરા એસ્ટેટના સેક્ટરમાં એક રીટેઈલ નેટવર્ક ઊભું કરશે તેવા લક્ષ્યાંક સાથે આવી હતી અને તેથી તે શેરને આઈપીઓ વખતે તો જોરદાર રિસ્પોન્સ મળ્યો હતો પરંતુ તે પછી તેને એક્ઝીક્યુશન કહીએ તે રીતે આ કંપની નિષ્ફળ ગઈ છે અને અમૂક ગણ્યાગાઠ્યા સ્ટોર સિવાય તેનું કોઈ જ રીટેઈલ નેટવર્ક નથી દેખાતું અને તેથી આવા ઊંચા વેલ્યૂએશન ઉપર તેજીના તબક્કામાં આ શેર ચાલી શકે બાકી આ શેર માટે ૪૭નો પીઈરેશિયો સહેજ પણ યોગ્ય નથી અને તેમાં ગમે ત્યારે ગાબડું પડી જાય તે ભય મોટો છે અને તેથી રોકાણ હોય તો ઘટાડતા જવું ખૂબ જ સલાહભરેલ.

**પીડીલાઇટ**નો શેર રૂા. ૨૪૪૦ ઉપર છે અને તેમાં વેલ્યૂએશન ખૂબ જ મોંઘું છે. ૯૮ના પીઈરેશિયોવાળા આ શેરમાં ગમે ત્યારે મોટું ગાબડું પડી જાય તે ભય છે તેમ છતાં એધેઝીવના માર્કેટમાં આ કંપનીની મોનોપોલી જ કહી શકાય. તે જ પ્રકારે તેના વોટરપ્રૂફ પેઈન્ટ ડો. ફિક્સિટમાં પણ જોરદાર માંગ ઊભી થઈ છે. એશિયન પેઈન્ટે ભલે વોટરપ્રૂફ પેઈન્ટ લોન્ચ કર્યો હોય પરંતુ ડોક્ટર ફિક્સીટની હરિફાઈમાં પાછો પડે છે અને પીડીલાઈટ અન્ય પ્રકારના કેમિકલ્સ અને ખાસ કરીને ઓટોમોબાઈલના કેમિકલ્સમાં પણ અગ્રેસર છે અને આ તમામ પાસાને ધ્યાનમાં રાખીએ તો અતિશય ઊંચા વેલ્યૂએશનવાળા આ શેરમાં રોકાણ જાળવી શકાય. આ કંપની ગમે ત્યારે પેઈન્ટના બિઝનેસમાં પણ ઝંપલાવી દે


તે સંભાવના પણ છે અને તેથી પીડીલાઈટના શેરમાં રોકાણ જાળવી

તો સહેજેય નવાઈ નહિ લાગે. અથવા

તો ફેવિકોલની સાથે સાથે વુડન પેઈન્ટ

કે એવી કોઈ પ્રોડક્ટ પણ લોન્ચ કરી દે

પેઈન્ટ કંપનીઓના નફા ક્રૂડ આધારિત છે અને તેથી ક્રૂડના ભાવની તેજીને કારણે પેઈન્ટ કંપનીઓની



નફાશક્તિને અસર પડે તે ભય ખૂબ મોટો છે અને તેથી શોર્ટટર્મમાં આ શેરો પણ દબાણ હેઠળ રહેવાની સંભાવના

એશિયન પેઇન્ટ અત્યારે રૂા. ૩૧૯૯ ઉપર ચાલે છે અને આ શેર અત્યારે મંદીના તબક્કામાં ફસાયો છે. આવતા થોડા દિવસો દરમ્યાન આ શેરમાં વધારે ઘટાડા સાથે રૂા. ૩૧૪૮ અને તે પછી રૂા. ૩૦૭૩નો ભાવ જોવા મળી જાય તો નવાઈ નહિ લાગે અને ઘટાડાનો ઉપયોગ કરીને તેમાં રોકાણ

વધારી શકાય. બીજી તરફ અન્ય પેઈન્ટ શેરો ફ્લતેજીમાં અતિશય ઊંચા વેલ્યૂએશન ઉપર પહોંચાડી દેવાયા હતા અને હવે તેમાં ગાબડા પડવાનો ભય ખૂબ મોટો છે. ખાસ કરીને **બર્જર પેઇન્ટ** એમ પણ રૂા. ૮૭૨ના લેવલથી ધીરે ધીરે ઘટીને રૂા. ૭૧૫ ઉપર તો આવી ગયો છે અને આવતા થોડા દિવસોમાં વધારે ઘટીને રૂા. ૬૭૭ ઉપર આવી જાય તો સહેજેય નવાઈ નહિ લાગે. **એક્ઝો પેઇન્ટ** રૂા. ૧૮૮૪ ઉપર આવ્યો છે અને તેમાં પણ વેલ્યૂએશન અતિશય મોંઘું છે. આવતા થોડા દિવસોમાં આ શેરમાં રૂા. ૧૮૫૮ અને તે તૂટે તો એક તબક્કે રૂા. ૧૮૧૮નો ભાવ પણ આવી શકે અને ઘટાડાનો આ તબક્કો હવે છેલ્લા થોડા દિવસો પૂરતો બાકી રહ્યો છે તે ખાસ ધ્યાનમાં રાખવું.

શાલિમાર **પેઇન્ટ**માં પણ વેલ્યૂએશન ખૂબ મોંઘું છે અને તેમાં પણ હાલના તબક્કે તીવ્ર ઘટાડાની જગ્યા છે. જાપાનીઝ પેઈન્ટ કંપની

કન્સાઈન નેરોલેક છેલ્લા થોડા દિવસોમાં રૂા. ૬૭૫ના ટોપથી ઘટીને રૂા. ૫૦૫ ઉપર તો આવી ગયો હવે આ શેરમાં વધારે ઘટાડાની જગ્યા નહિવત છે. ખૂબ જ તીવ્રતાથી ઘટ્યો હોવાથી આ શેરમાં હવે બાઉન્સ બેક અને ઉછાળો આવે તેવી ગણતરી છે.

**ઇન્ડિંગો પેઇન્ટ** દ્વારા પણ ફુલતેજીના સમયગાળામાં આઈપીઓમાં બરાબર ચીરીની ભાવ લેવાયો હતો. અને આઈપીઓમાં તે વખતે ગ્રે-માર્કેટ અને અન્ય કારણોસર લોકો ઉત્સાહથી ભરતા પણ હતા પરંતુ આ માહોલ લાંબો ન ટકે અને તેથી ઇન્ડિગોના શેરમાં છેલ્લા ઘણા દિવસોથી સતત વેચવાલી છે. અત્યારે રૂા. ૧૯૩૪ ઉપર આવી ગયેલા આ શેરમાં હજી રૂા. ૧૮૯૮નો ભાવ પાડી દેવાય તો પણ નવાઈ નહિ લાગે. આ શેરમાં મોટા ઘટાડાની જગ્યા હોવાથી થોડો વખત દૂર રહેવું ખૂબ જ

ઈલેક્ટ્રિક કેબલ કંપનીઓમાં **પોલિકેબ** દ્વારા ખૂબ જ સુંદર નફાશક્તિ હાંસલ થઈ છે તેમ છતાં આ શેર પણ છેલ્લા ઘણા સમયથી ધીરે ધીરે ઘટીને રૂા. ૨૩૭૦ ઉપર આવ્યો છે. અને હજી થોડો સમય આ શેરમાં હજી ઘટાડો જોવાય તેવી ગણતરી છે. નીચામાં રૂા. ૨૨૮૨ સુધી ભાવ ઉતરી જાય તે સંભાવના છે. અને તેથી તેમાં ભાવ વધારે તૂટે ત્યાં સુધી થોડીક રાહ જોવી અને તે પછી વેલ્યૂબાઈંગની રીતે થોડાક શેરો લઈને મૂકી દેવા.

સામે પક્ષે **ફિનોલેક્સ કેબલ**ના આંકડા એકંદરે સામાન્ય આવ્યા છે. એક સમયે ભલે આ શેરમાં તોફાની સટ્ટો ચાલતો હતો, પરંતુ હવે ફ્રેન્સી બધી પોલિકેબે ખેંચી લીધી છે અને અત્યારના રૂા. ૪૮૩વાળા આ શેરમાં આવતા થોડા દિવસોમાં મોટા ગાબડા સાથે ર્રા. ૪૬૪નો ભાવ જોવા મળી જવાની

### PRATIKSHA CHEMICALS LIMITED

EXTRACT FROM THE STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE

DHARNIDHAR DERASAR, VASNA, AHMEDABAD - 380007

CIN: L24110GJ1991PLC015507 www.pratikshachemicals.in PH: 079-26632390 E-MAIL: exports@dharapratiksha.com

QUARTER AND NINE MONTH ENDED ON 31.12.2021 Quarter For the Corresponding 3 Months nine ended on **PARTICULARS** month ended on 31.12.2020 31.12.2021 1179.85 Total income from operations 407.71 287.22 Net Profit / ( Loss ) for the period (before Tax, Exceptional 12.29 49.48 14.35 and/or Extraordinary items) Net Profit / (Loss ) for the period before Tax (after 12.29 49.48 14.35 Exceptional and/or Extraordinary items) Net Profit / (Loss) for the period after Tax (after 42.43 Exceptional and/or Extraordinary items) 9.94 14.25 Total Comprehensive Income for the period [Comprising Profit/ (loss) for the period (after tax) and other 9.94 42.43 14.25 Comprehensive Income (after tax)] Equity Share Capital 557.03 557.03 557.03 Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of Previous Year -217.74 -217.74 -233.68 Earnings Per Share (of Rs. 10 / - each) (for continuing and discontinued operations) 0.18 0.76 0.26 0.76 0.26 Diluted 0.18

1. The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchange under Regulation 33 of SEBI (Listing and Other Disclosure Requirements) Regulation, 2015. The full Format of the financial Results are available on the Stock Exchange website (www.bseindia.com) and on the Company website ( www.pratikshachemicals.in )

2. The result of the Quarter ended on 31st December, 2021 were reviewed by the Audit Committee and approved by the Board of Director at its meeting held on 11th February, 2022.

> SD/-**JAYESH PATEL** DIRECTOR

> > (DIN: 00401109)

Place: Ahmedabad Date: 11th February,2022 BY ORDER OF THE BOARD OF DIRECTORS, FOR, PRATIKSHA CHEMICALS LIMITED